

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટનનું સ્થાનિક બિન-નફાકારક અને સખાવતી સંસ્થાઓને સહાયતા આપવા માટે લગભગ \$600,000નું
યોગદાન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (06 મે 2022) – 64 સ્થાનિક બિન-નફાકારક સંસ્થાઓ અને રજીસ્ટર થયેલ સખાવતી સંસ્થાઓને 2022 દરમિયાન એડવાન્સ બ્રેમ્પટન ફંડના માધ્યમથી સહાય આપવા માટે લગભગ \$600,000નો ફાળો આપે છે જેમાં અનુદાનના મૂલ્ય \$5,000 થી \$25,000 જેટલા હશે.

બ્રેમ્પટન COVID-19ની મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે આ ભંડોળ સમુદાયને ઓ નિર્ભર છે એવા મહત્વપૂર્ણ પ્રોગ્રામ્સ પ્રદાન કરે તે અગત્યનું છે. એડવાન્સ બ્રેમ્પટન ફંડના માધ્યમથી સહાયતા મેળવનારી સંસ્થાઓમાં નીચે આપેલ સંસ્થાઓ સામેલ છે: અસીસ ફાઉન્ડેશન (Asees Foundation), લેડી બેલર્સ કેમ્પ (Lady Ballers Camp), વન વોઈસ વન ટીમ યુથ લિડરશીપ ઓર્ગનાઈઝેશન (One Voice One Team Youth Leadership Organization), પંજાબી કમ્યુનિટી હેલ્થ સર્વિસિસ (Punjabi Community Health Services), બિગ બ્રદર્સ (Big Brothers), બિગ સિસ્ટર્સ ઓફ પીલ (Big Sisters of Peel), બ્યો આર્ટ્સ બ્રેમ્પટન (Beaux Arts Brampton) 2022 એડવાન્સ બ્રેમ્પટન ફંડના અનુદાન પ્રાપ્તકર્તાઓની પૂર્ણ સૂચિ અહીં મળશે brampton.ca/abf.

COVID-19 મહામારી દરમિયાન ઉપલબ્ધ સંસાધનોની તંગી અને અળગાપણાથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો ખૂબ પ્રભાવિત થયા હતાં. [ઇન્ડસ કમ્યુનિટી સર્વિસિસ \(Indus Community Services\)](http://induscommunityservices.ca) માટે, “ એડવાન્સ બ્રેમ્પટન ફંડ અમને આપણા વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવામાં મદદરૂપ થશે જેમાં તેઓ પોતાની સંસ્કૃતિઓના દર્શન કરાવી શકશે અને કલા, વાર્તાલાપ, વ્યાયામ, કેળવણી અને નિરોગી ખાદ્ય આદતોના માધ્યમથી પોતાના કૌશલ્યો વિકસાવી શકશે. અમને અમારા અસીલોને વ્યક્તિગત રીતે અને વર્ચ્યુઅલી એટલે કે ઓનલાઈન માધ્યમથી આ પ્રોગ્રામિંગ રજૂ કરતા આનંદ થાય છે.

બ્રેમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સુરક્ષિત શહેર છે, અને [અસીસ ફાઉન્ડેશન \(Asees Foundation\)](http://aseesfoundation.ca) તે સક્રિય રહેવાની કિંમત શું છે તેનાથી અવગત છે. “એડવાન્સ બ્રેમ્પટન ફંડ અમને અમારા યુવા લોકો અને સમાજના અન્ય વ્યક્તિઓ માટેની ગેટ એક્ટિવ ઈનિશિએટીવને વિસ્તારવાનો અવસર આપશે. યુવાનોને શારીરિક તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીનું જ્ઞાન અને સમજ વિકસાવવામાં મદદ કરવામાં આ યોગદાનોથી જબરદસ્ત ફેર પડશે.

લેડી બેલર્સ કેમ્પ માટે, સમુદાયને એક મૂલ્યવાન કાર્યક્રમ પલોચાડવાની તેમની ક્ષમતા માટે આ ભંડોળ મહત્વપૂર્ણ હતું. 2021માં અનુદાન પ્રાપ્તકર્તાઓ તરીકે તેનાથી તેમનો સમર કેમ્પ 2.0 - રાઈટ ટૂ લર્ન રાઈટ ટૂ પ્લે સફળ થઈ શક્યો હતો. "અમારો પ્રોગ્રામ અમારી અપેક્ષાઓ વટાવી ગયો, જેમાં અમે 246 બાળકો અને યુવાઓ સુધી પલોચી શક્યા અને કેટલાયે યુવા જીવનમાં આનંદનો સંચાર કરી શક્યા હતા. 2021ની પાનખરમાં, અમે અકેડેમિક ટ્યુટરિંગ અને ગૃહકામમાં સહાયતા આપી શક્યા હતા, અને સાથે જ માનસિક સુખાકારી પ્રોગ્રામિંગ જે આવા અસાધારણપણે મુશ્કેલ સમયમાં મહત્વપૂર્ણ પુરવાર થઈ હતી. 2022 પ્રોગ્રામનું ભંડોળ કેમ્પને તેમના 8-સપ્તાહના સમર કેમ્પ અને 14-સપ્તાહના બેક-ટુ-સ્કૂલ પ્રોગ્રામિંગને રજૂ કરવામાં મદદ કરશે, અસ્વેત બાળકીઓ અને ગરીબ યુવાનોને શારીરિક વ્યાયામ, ભાવનાત્મક સુખાકારી, સામાજિક સંબંધો સ્થાપવાનો, અને મહત્વપૂર્ણ શૈક્ષણિક સહાય મેળવવાનો અવસર આપશે.

સ્થાનિક બિન-નફાકારક અને સખાવતી સંસ્થાઓને વધુ સમર્થન આપવા માટે, એડવાન્સ બ્રેમ્પટન ઈંડ ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટીના (જે અગાઉ રાયરસન યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી) [જી રેમન્ડ ચાંગ સ્કૂલ ઓફ કન્ટિન્યુઈંગ એડ્યુકેશન \(G. Raymond Chang School of Continuing Education\)](#) સહયોગ કર્યો જેથી બિન-નફાકારક સેક્ટર ડિવલપમેન્ટ વર્કશોપ્સ રજૂ કરી શકાય જે સંસ્થાઓને પોતાની ક્ષમતા વિસ્તારવા પર અને સેક્ટર શિક્ષણ અને કૌશલ્યોના વિકાસ પર કેન્દ્રિત છે. નવેમ્બર 2021થી અત્યાર સુધીમાં 11 સત્રોનું આયોજન થયું જેમાં 250 સહભાગીઓએ ભાગ લીધો હતો. આગામી શ્રેણીની શરૂઆત પાનખરમાં થશે.

એડવાન્સ બ્રેમ્પટન ઈંડ વિશે

એડવાન્સ બ્રેમ્પટન ઈંડ \$6,00,000 કમ્યુનિટી અનુદાન પ્રોગ્રામ છે જે લાયક ઠરેલી બ્રેમ્પટન સ્થિત બિન-નફાકારક અથવા સખાવતી સંસ્થાઓને એવા પ્રોગ્રામ્સ અને સેવાઓ રજૂ કરવા માટે ભંડોળ પ્રદાન કરશે જે સમુદાયની જરૂરિયાતો સંતોષે અને ટર્મ ઓફ કાઉન્સિલની પ્રાથમિકતાઓને આગળ ધપાવે.

નીચેના ત્રણ ધારાઓ છે:

- **ઉભરતા** - નવા અને નવા પ્રોજેક્ટ માટે મેચિંગ ઈંડમાં \$5,000 સુધીની રકમ પ્રદાન કરે છે
- **વિકાસ** - ઓછામાં ઓછી એક વખત બ્રેમ્પટનમાં આયોજાયેલ પ્રોગ્રામ્સ માટે \$12,500નો મેચિંગ ઈંડ પ્રદાન કરે છે
- **એમ્પ્લીફાઈંગ** - ઓછામાં ઓછી બે વખત બ્રેમ્પટનમાં આયોજાયેલ પ્રોજેક્ટ માટે \$25,000નો મેચિંગ ઈંડ પ્રદાન કરે છે

અનુદાન અરજીઓનો આગામી રાઉન્ડ 2022 પાનાખરમાં ખુલ્લો જોઈ 2023માં થનાર પ્રોજેક્ટ્સને સહાય કરી શકાય. 2022 એડવાન્સ બ્રેમ્પટન ફંડના અનુદાન પ્રાપ્તકર્તાઓની પૂર્ણ સૂચિ અને પ્રોગ્રામ અંગેની વધુ જાણકારી માટે અહીં મુલાકાત લો brampton.ca/abf.

સુવાક્યો

"બ્રેમ્પટન અવસરોનું શહેર છે અને મને આપણી સ્થાનિક બિન નફાકારક સંસ્થાઓ પર એડવાન્સ બ્રેમ્પટન ફંડનો જે પ્રભાવ પડી રહ્યો છે તે જોતા મને આનંદ થાય છે. આપણે COVID-19 ની મહામારીમાંથી ફરી ઊભા થઈ રહ્યા છીએ ત્યારે તેઓ જે સંસાધનો પ્રદાન કરે છે તે ખૂબ જ જરૂરી સહાય પૂરી પાડે છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"એડવાન્સ બ્રેમ્પટન ફંડ માત્ર ભંડોળ જ નહીં પરંતુ તે ઉપરાંત આપણા બ્રેમ્પટન સ્થિત બિન નફાકારક સંસ્થાઓ માટે એવો અવસર પ્રદાન કરે છે જેથી તેઓ આપણા શહેરને જરૂર છે એવા પ્રોગ્રામ્સ અને સેવાઓ આપી શકે. સમુદાય અને આ મહત્વપૂર્ણ સંસાધનો પ્રદાન કરતી સંસ્થાઓ પર આ ભંડોળનો પ્રભાવ જોવો તે ખરેખર અદ્ભુત છે."

- હરકિરત સિંઘ, સિટી કાઉન્સિલર, વોર્ડ 9 અને 10, પ્રમુખ, કોર્પોરેટ સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"અમારા એડવાન્સ બ્રેમ્પટન ફંડ દ્વારા બ્રેમ્પટન સ્થિત બિન-નફાકારી અને સખાવતી સંસ્થાઓ માટે ભંડોળ મેળવવાના અવસર પૂરા પાડીને અમારી વૈવિધ્યસભર વસ્તીની જરૂરિયાતોને સહાય આપવા માટે સિટી ઓફ બ્રેમ્પટનને ગર્વ છે. આ જૂથો સમુદાયમાં જે હકારાત્મક તફાવત લાવે છે તે જોવા માટે અમે ઉત્સુક છીએ."

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ



Media Release

કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca